

INFORMATION REGARDING 39th ANNUAL GENERAL MEETING TO BE HELD THROUGH VIDEO CONFERENCE ("VC") / OTHER AUDIO VISUAL MEANS ("OAVM")

Annual General Meeting:

Shareholders may note that the 39th Annual General Meeting ("AGM") of the Company will be held through VC/OAVM on Friday, July 18, 2025 at 11.00 a.m. IST, in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and Rules issued thereunder and the Securities and Exchange Board of India ("SEBI") (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with General Circular No. 14/2020 dated April 08, 2020, Circular No.17/2020 dated April 13, 2020 issued by the Ministry of Corporate Affairs ("MCA") followed by Circular No. 20/2020 dated May 05, 2020, Circular No. 02/2021 dated January 13, 2021 and Circular No. 10/2022 dated December 28, 2022, Circular No. 09/2023 dated September 25, 2023, Circular No. 09/2024 dated September 19, 2024 extension for holding AGM through VC and Master Circular No. SEBI/HO/CFD/CFDPoD-2/P/CIR/2023/167 dated October 07, 2023, SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2024/133 dated October 03, 2024 issued by SEBI, along with other applicable Circulars issued in this regard by the MCA and SEBI, to transact the business that will be set forth in the Notice of the AGM.

In compliance with the above Circulars, the Company will be sending electronic copies of the Notice of the AGM and Integrated Annual Report for the financial year 2024-25 to all the shareholders whose email addresses are registered with the Company/Registrar and Share Transfer Agent/Depository Participant(s) ("DP"). The Notice of the AGM and Integrated Annual Report for the financial year 2024-25 will also be made available on the Company's website at www.nilkamal.com, on the website of Stock Exchanges where the equity shares of the Company are listed, BSE Limited at www.bseindia.com, National Stock Exchange of India Limited at www.nseindia.com and on the website of National Securities Depository Limited ("NSDL") at www.evoting.nsdl.com.

Voting information:

The Company is pleased to provide remote e-voting facility to the Members to cast their votes electronically on all the resolutions set forth in the Notice convening the said Meeting. The facility of e-voting will also be made available at the AGM and Members attending the AGM through VC/OAVM, who have not cast their vote by remote e-voting, will be able to vote at the AGM. The Company has availed the services of NSDL to provide the facility of remote e-voting/e-voting at the AGM.

The remote e-voting period begins on Tuesday, July 15, 2025 (at 9:00 A.M. IST) and ends on Thursday, July 17, 2025, (at 05:00 PM IST). During this period shareholders of the Company, holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date Friday, July 11, 2025 may cast their vote electronically. The remote e-voting module shall be disabled by NSDL for voting thereafter. The voting rights of Members shall be in proportion to their shares in the paid-up equity share capital of the Company as on the cut-off date i.e. Friday, July 11, 2025.

The Board of Directors of the Company have appointed Mr. Bhaskar Upadhyay (FCS 8663, CP 9625), Partner M/s. N. L. Bhatia & Associates, Practicing Company Secretary, as the Scrutinizer for conducting voting process in a fair and transparent manner.

Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after sending of the Notice and holding shares as of the cut-off date, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in. However, if he/she is already registered with NSDL for remote E-voting then he/she can use his/her existing User ID and password for casting the vote.

The detailed instructions for joining the AGM through VC/OAVM and casting the vote through remote e-voting / e-voting at the AGM is provided in the Notice of AGM. Members are requested to carefully go through the same. Members, who need assistance before or during the AGM regarding e-voting facility and/or VC/OAVM facility, can send a request at evoting@nsdl.co.in or call on: 022-48867000.

Payment of final dividend:

Shareholders may note that the Board of Directors of the Company at their meeting held on Wednesday, May 14, 2025 have approved and recommended payment of final dividend of Rs. 20 (Rupees Twenty only) ("final dividend") per equity share of face value of Rs. 10 (Rupee Ten Only) each fully paid up for the financial year ended March 31, 2025, subject to approval of shareholders at the ensuing AGM of the Company. The final dividend, if approved, by the shareholders will be paid on or after Friday, July 25, 2025 to the shareholders whose names appears in the Register of Members or Register of Beneficial Owners, as on the close of Friday, July 11, 2025. Further, Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Saturday, July 12, 2025 to Friday, July 18, 2025 (both days inclusive) for the purpose of Annual General Meeting and dividend.

The final dividend will be paid electronically through various online transfer modes to those shareholders who have updated their bank account details. For shareholders who have not updated their bank account details, dividend warrants/demand drafts will be sent to their registered address in due course.

As shareholders may be aware, as per the Income Tax Act, 1961 ("IT Act"), as amended by the Finance Act, 2020, dividends paid or distributed by the Company after April 01, 2020, shall be taxable in the hands of the shareholders and the Company shall be required to deduct tax at source ("TDS") at the prescribed rates from the dividend, subject to approval of shareholders at the ensuing AGM. The TDS rate would vary depending on the residential status of the shareholders and the documents submitted by them and accepted by the Company.

The said information along with the detailed tax rates, exemption forms and other documents required for availing the applicable tax rates are available on the Company's website at <https://www.nilkamal.com>.

Shareholders are requested to submit the documents in accordance with the applicable provisions of the IT Act.

The shareholders are requested to note that as per the provisions of the SEBI, it is mandatory for all shareholders holding shares in physical form to furnish PAN, Choice of Nomination, Contact details (Postal Address with PIN and Mobile Number), Bank A/c details and Specimen signature for their corresponding folio numbers.

The shareholders may register/update the said details in the prescribed Form (SR-1 and other relevant forms with MUGF Intime India Private Limited ("Link Intime"), Registrar and Share Transfer Agent of the Company. Further, the shareholders can also access the relevant forms on the Company's website at <https://www.nilkamal.com>.

The above information is being issued for the information and benefit of all the shareholders of the Company and is in compliance with the applicable MCA and SEBI Circular(s). The shareholders may contact the Company's Registrar and Share Transfer Agent at MUGF Intime India Private Limited, C-101, 1 Floor, 247 Park, Lal Bahadur Shastri Marg, Vikhroli (West), Mumbai-400083 Tel No: +91 8108116767 Email: mt.helpdesk@in.mnps.mugf.com

By Order of the Board of Directors

Nilkamal Limited

Sd/-

Sagar Mehta
Company Secretary & Compliance Officer

Place: Mumbai

Dated: 23rd June, 2025

THE BUSINESS DAILY FOR DAILY BUSINESS

FINANCIAL EXPRESS



TATA POWER

The Tata Power Company Limited
(Mundra Thermal Power Station - UMPP)Tunda Vandi Road, Tunda Village, Mundra, Kutch, Gujarat
Reg. Office: Bombay House, 24 Homi Modi Street, Mumbai - 400 001

NOTICE INVITING EXPRESSION OF INTEREST

The Tata Power Company Limited hereby invites Expression of Interest (EOI) from eligible bidders for the following requirement:

1. Outline Agreement for supply of Caustic Soda lye (Liquid). (Ref: 4100049335)
2. Retrofitting work of LT Bunkers. (Ref: 4100049387)
3. Supply of a 3-Phase, 6.6kV, 425kW Squirrel Cage Induction Motor for an Atlas Copco Air Compressor (Ref: 4100049275).
4. Procurement of Submersible pumps - 50 HP, MOC-DUPLEX & 10 HP, MOC-SS 316L (Ref: 4100049392)

For prequalification requirements, tender fee, bid security etc., please visit Tender section of our website (URL: <https://www.tatapower.com/tender/tenders-listing>) and refer detailed Tender Notice for subject tender. Eligible bidders willing to participate in this tender may submit their Expression of Interest along with the Tender Fee latest by 07/07/2025.



NMDC Limited

(A Government of India Enterprise)

10-3-311/A, CASTLE HILLS, MASAB TANK, HYDERABAD-500028

Telephone: 040-23536740, 23538713 to 23538721 Ext: 535

EMAIL: kyprakash@nmdc.co.in, jvenkatesan@nmdc.co.in

Global Tender Notice (E-Procurement Mode Only)

Tender No. NMDC/HO/MM/PURCH/2024/42 Dtd. 21.06.2025

(MSTC Ref no: NMDC/Head Office/Material Management/8/25-26/ET/241)

E-tenders are invited for following items from reputed manufacturers directly or through their dealers / accredited agents through MSTC portal website https://www.mstcecommerce.com/eprochome/nmdc/buyer_login.jsp.

Description	Qty (No)	Pre-bid meeting date	Display & Sale of Tender Documents Period	Last date & Time for submission of offer
Supply and Erection & Commissioning of 10 Nos. 9-11 Cu.M Hydraulic Excavators (Deterated to 8-9 Cu.M) including COST CAP/MARC (03 nos. under MARC & 07 nos. under COST CAP) for 12 Years/32000 Hrs., whichever is earlier.	10	27.06.25	FINAL 07.07.25 to 28.07.25	28.07.25 By 02.30 PM (IST)

Prospective bidders may visit our websites: www.nmdc.co.in; CPP Portal <https://eprocure.gov.in>; <https://mstcecommerce.com> and may download the tender documents. Any corrigendum to the above tender notice will be uploaded on our website and MSTC e-portal only. GM (Materials)

HSBC MUTUAL FUND
NOTICE

Notice is hereby given that the Trustees of HSBC Mutual Fund have approved the declaration of dividends under the Income Distribution cum Capital Withdrawal (IDCW) option of the following schemes of HSBC Mutual Fund:

Sr. No.	Scheme/ Plan/ Option	Quantum of Dividend (in ₹ per unit)	NAV of the IDCW Option (as on June 19, 2025) (in ₹ per unit)
1.	HSBC Credit Risk Fund - Regular Plan - IDCW Option	0.070	11.4862
2.	HSBC Credit Risk Fund - Direct Plan - IDCW Option	0.075	12.4957
3.	HSBC Medium Duration Fund - Regular Plan - IDCW Option	0.065	10.7133
4.	HSBC Medium Duration Fund - Direct Plan - IDCW Option	0.070	11.7612
5.	HSBC Aggressive Hybrid Fund - Regular Plan - IDCW Option	0.175	28.0691
6.	HSBC Aggressive Hybrid Fund - Direct Plan - IDCW Option	0.205	33.2684
7.	HSBC Balanced Advantage Fund - Regular Plan - IDCW Option	0.120	19.4846
8.	HSBC Balanced Advantage Fund - Direct Plan - IDCW Option	0.140	23.0862
9.	HSBC Medium to Long Duration Fund - Regular Plan - Quarterly IDCW Option	0.190	10.9235
10.	HSBC Medium to Long Duration Fund - Direct Plan - Quarterly IDCW Option	0.195	10.9432
11.	HSBC Conservative Hybrid Fund - Regular Plan - Quarterly IDCW Option	0.330	17.8567
12.	HSBC Conservative Hybrid Fund - Direct Plan - Quarterly IDCW Option	0.290	15.6443
13.	HSBC Equity Savings Fund - Regular Plan - Quarterly IDCW Option	0.300	15.9894
14.	HSBC Equity Savings Fund - Direct Plan - Quarterly IDCW Option	0.330	17.6363
15.	HSBC Gilt Fund - Regular Plan - Quarterly IDCW Option	0.200	11.0609
16.	HSBC Gilt Fund - Direct Plan - Quarterly IDCW Option	0.230	12.7882
17.	HSBC Corporate Bond Fund - Regular Plan - Quarterly IDCW Option	0.200	11.2456
18.	HSBC Corporate Bond Fund - Direct Plan - Quarterly IDCW Option	0.210	11.6572
19.	HSBC Short Duration Fund - Regular Plan - Quarterly IDCW Option	0.195	10.7647
20.	HSBC Short Duration Fund - Direct Plan - Quarterly IDCW Option	0.215	11.6335

Record Date: June 25, 2025. Face Value: Rs 10 per unit

The above dividend is subject to availability of distributable surplus and may be lower to the extent of distributable surplus available on the record date. Pursuant to payment of dividend, the NAV of the IDCW option of the above-mentioned schemes/ plans will fall to the extent of dividend distribution and statutory levy, if any.

All the unitholders of the above schemes whose names appear on the register of unitholders as on the record date will be eligible to receive the dividend.

For & on behalf of HSBC Asset Management (India) Private Limited
(Investment Manager to HSBC Mutual Fund)

Sd/-

Authorised Signatory

Mumbai, June 22, 2025



Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

HSBC Asset Management (India) Private Limited, 9-11 Floors, NESCO IT Park, Building no. 3, Western Express Highway, Goregaon (East), Mumbai - 400 063, India.
Email: investor.line@mutualfunds.hsbc.co.in, Website: www.assetmanagement.hsbc.co.in
Customer Service Number - 1800 200 2434/ 1800 4190 200
Issued by HSBC Asset Management (India) Private Limited
CIN-U74140MH2001PTC134220

NOTICE

Declaration of Distribution (of Income & Capital) (previously Referred as Dividend) Under Various Schemes of Axis Mutual Fund

Axis Mutual Fund Trustee Limited, Trustee to Axis Mutual Fund ("the Fund") has approved the declaration of Distribution (of Income & Capital) (previously referred as dividend) under the Income Distribution cum Capital Withdrawal (IDCW) options of following schemes, the particulars of which are as under:

Name of the Schemes /Plans	Quantum of Distribution (of income & capital) (₹ per unit)*	Record Date*	Face Value (per Unit ₹)	NAV as on June 20, 2025 (per unit ₹)
Axis Arbitrage Fund - Direct Plan - Monthly IDCW	0.05	June 25, 2025	10	12.1990
Axis Arbitrage Fund - Regular Plan - Monthly IDCW				11.1637
Axis Equity Savings Fund - Direct Plan - Monthly IDCW Option	0.09			13.86
Axis Equity Savings Fund - Regular Plan - Monthly IDCW Option				11.84
Axis Equity Savings Fund - Direct Plan - Quarterly IDCW Option	0.27			14.31
Axis Equity Savings Fund - Regular Plan - Quarterly IDCW Option				12.42
Axis Aggressive Hybrid Fund - Direct Plan - Monthly IDCW Option	0.10			16.59
Axis Aggressive Hybrid Fund - Regular Plan - Monthly IDCW Option				13.45
Axis Aggressive Hybrid Fund - Direct Plan - Quarterly IDCW Option	0.30			15.81
Axis Aggressive Hybrid Fund - Regular Plan - Quarterly IDCW Option				14.05
Axis Multi Asset Allocation Fund - Direct Plan - Monthly IDCW Option	0.15			25.8788
Axis Multi Asset Allocation Fund - Regular Plan - Monthly IDCW Option				19.1958
Axis Income Plus Arbitrage Active FOF - Direct Plan - Quarterly IDCW Option	0.10			12.0061
Axis Income Plus Arbitrage Active FOF - Regular Plan - Quarterly IDCW Option	0.15			11.4595
Axis Dynamic Bond Fund - Direct Plan - Quarterly IDCW Option	0.10			11.3083
Axis Dynamic Bond Fund - Regular Plan - Quarterly IDCW Option				11.3610
Axis Strategic Bond Fund - Direct Plan - Quarterly IDCW Option	0.20			10.6510
Axis Strategic Bond Fund - Regular Plan - Quarterly IDCW Option				10.4270
Axis Conservative Hybrid Fund - Direct Plan - Quarterly IDCW Option	0.20			13.4153
Axis Conservative Hybrid Fund - Regular Plan - Quarterly IDCW Option				11.1146
Axis Long Duration Fund - Direct Plan - Quarterly IDCW Option	2.50		1000	1209.3795
Axis Long Duration Fund - Regular Plan - Quarterly IDCW Option				1195.6222
Axis Money Market Fund - Direct Plan - Quarterly IDCW Option	10.00			1168.6693
Axis Money Market Fund - Regular Plan - Quarterly IDCW Option				1155.9627
Axis Floater Fund - Direct Plan - Quarterly IDCW Option	3.00			1261.4890
Axis Floater Fund - Regular Plan - Quarterly IDCW Option				1244.6516

*As reduced by the amount of applicable statutory levy, if any.

*or the immediately following Business Day if that day is not a Business Day.

Pursuant to payment of IDCW, the NAV of the above stated IDCW options of the schemes/plans would fall to the extent of payout and statutory levy, if any.

The Distribution would be paid to the beneficial owners / unit holders whose names appear in the statement of beneficial owners maintained by the depositories under the said schemes/plans at the close of business hours on the record date and to the unit holders holding units in physical form, whose names appear in the Register of unit holders maintained with Registrar and Transfer Agent under the IDCW options of the schemes/plans as at the close of the business hours on the record date.

Investors may kindly note that declaration of Distribution is subject to availability of distributable surplus on the record date / ex-distribution date. In case the distributable surplus is less than the quantum of Distribution on the record date / ex-distribution date, the entire available distributable surplus in the schemes/plans will be declared as Distribution.

Investors are requested to kindly take note of the above.

For Axis Asset Management Company Limited
(CIN - U65991MH2009PLC189558)
(Investment Manager to Axis Mutual Fund)

Sd/-

Gop Kumar Bhaskaran
Managing Director & Chief Executive Officer

Place: Mumbai
Date: June 22, 2025
No.: 33/2025-26

Axis Bank Limited is not liable or responsible for any loss or shortfall resulting from the operation of the scheme.
Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.



One Lodha Place, 22nd & 23rd Floor, Senapati Bapat Marg, Lower Parel, Mumbai, Maharashtra, Pin Code - 400 013, India.
TEL: (022) 6649 6100, EMAIL: customerservice@axismf.com, WEBSITE: www.axismf.com.

વીઆઈએ અને સંસ્થાઓ દ્વારા
વાપીમાં યોગશિબિર યોજાઈ



(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૨ : આજે વાપીમાં વીઆઈએ અને વિવિધ સામાજિક સંસ્થા દ્વારા વિશ્વ યોગ દિવસે નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સવારે ૬:૦૦થી ૭:૦૦ કલાક દરમિયાન યોગ શિબિરનું આયોજન કરાયું હતું.

તા. ૨૧.૬.૨૦૨૫ શનિવારના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે વાપી ઈન્ડસ્ટ્રીઝ વીઆઈએના પ્રમુખ સતિષભાઈ પટેલ સામાજિક સંસ્થા સાથે ગુજરાત

રાજ્યના નાણાં, ઊર્જા અને કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં સવારે ૬:૦૦થી ૭:૦૦ કલાક વાપી ખાતે આવેલ સોનાષ્ટ્ર પટેલ સમાજની વાડીના હોલમાં યોગશિબિરનું આયોજન કરેલ છે. જેમાં મોટી સંખ્યામાં લોકોને જોડવા અપીલ કરાય છે. જોકે યોગા કરવા માટે પોતાની યોગમેટ લઈ આવવા જણાવાયું છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન વીઆઈએના પ્રમુખ સતિષભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા કરાયું છે.

દમણગંગા ટાઈમ્સ

બીલપુડીમાં વરસાદી પાણીના ખાડામાં બાળકનું ડુબી જતાં મોત

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૨ : શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલની સામે જયંતીભાઈ પટેલના ઘરે શેરીના ડુંગળી ફળિયાના રમેશભાઈની પત્ની રીટાબેન રૂમમાં રહી છેલ્લા ચાર

વર્ષથી કામ કરી પતિ તથા ૧૬ વર્ષીય પુત્રી ક્ષુત્રીબેન અને ૧૩ વર્ષનો પુત્ર વંસિકા અને સૌથી નાનો પુત્ર ૧૧ વર્ષીય યશ સાથે રહી ગુજરાત ચલાવતા. શુક્રવારે રમેશભાઈ બપોરે તેમની છોકરી ક્ષુત્રીને હાથીખાના પાસે

આવેલ પાલિકા સ્કુલમાંથી લાવી ઘરે પહોંચાડી કામકાજ માટે બજારમાં ગયા હતાં. સાંજના પાંચ વાગ્યેનાં સુમારે પતિ રીટાબેને પતિ રમેશ ભાઈ ને ફોન કરી કહ્યું હતું કે, તેમની છોકરી ક્ષુત્રી અને યશ બન્ને જણા રમતા રમતા શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલનાં પ્રવેશદ્વાર ની બાજુમાં પેટ્રોલ પંપની કામગીરી ચાલુ રહી તે સ્થળે વરસાદી પાણી ભરેલા ખાડામાં પડી ગયા હોવાનું જણાવતા રમેશભાઈ ઘટના સ્થળે આવી પહોંચે તે પહેલા તેમની પતિ તથા બીજા માણસો દ્વારા

તેમની છોકરી ક્ષુત્રીને ખાડાના પાણીમાથી બહાર કાઢી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ લઈ જવાઈ હતી જ્યારે યશ ઉગ્ર પાણીમા ડુબી ગયો હોવાથી કાયર બ્રિગેડેને ટીમ ને બોલાવતા ખાડામા ઉતરી યશને બહાર કાઢી બેભાન હાલતમાં આંવેલી શ્રીમદ્ બાજુમાં રાજચંદ્ર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે ચેક કરી યશને મૃત જાહેર કર્યો હતો. જે ઘટના બાબતે આગળની કાર્યવાહી ધરમપુર પોલીસે હાથ ધરી હતી.

VIMAL ENTERPRISE

શું તમે ગળતા ટેરેસ, બાથરૂમ લીકેજ તથા દિવાલમાંથી આવતા ભેજના લીધે પરેશાન છો ? તો ચિંતા નહિ!

આવી ગયું છે હવે, “વિમલ એન્ટરપ્રાઈઝ” જે તમને આધુનિક મશીન તથા ગેરંટી સાથે વોટરપ્રુફિંગ કરી આપવામાં આવશે

Mo. 9374135780

Address: ઓફિસ નંબર 73 શિવ પૂજા સોસાયટી નંદાવાડા વલસાડ-396001

CONTACT-RAMBHAI KUSHWAHA.

તિથલમાં જિલ્લા કક્ષાના આંતરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી નિયમિત યોગાભ્યાસ ખૂબ જ જરૂરી: ધવલ પટેલ



(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૨ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી તિથલ સમુદ્ર કાંઠે સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ સ્વામી સભાગૃહમાં હપોલ્લાસભેર કરવામાં આવી હતી. યોગ બોર્ડના દક્ષિણ ગુજરાતના ઝોન કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડેએ મંચ સંચાલન કરી મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને ૪૫

મીનિટના કોમન યોગ પ્રોટોકોલમા પ્રાર્થના, યોગ આસન, પ્રાણાયામ, ધ્યાન અને સંકલ્પ લેવડાવી યોગનો મહિમા વર્ણવ્યો હતો. લોકસભાના દંડક અને વલસાડ - ડાંગના સંસદ સભ્ય ધવલભાઈ પટેલે જનમેદનીને સંબોધતા જણાવ્યું કે, યોગ એ ભારતની સમગ્ર વિશ્વને દેન છે. યોગ આપણા સ્વાસ્થ્યને પણ તંદુરસ્ત રાખે છે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે આપણે સંકલ્પ લઈએ કે, આજે માત્ર એક દિવસ નહિ પરંતુ આખા વર્ષ દરમિયાન નિયમિત યોગાભ્યાસ

કરીશું. રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી અને રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડનગરથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પ્રજાજનોને શુભેચ્છા પાઠવી પ્રસંગોચિત સંબોધન કર્યું હતું. જે કાર્યક્રમનું જીવંત પ્રસારણ થતા સોને નિહાળ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ BAPS વિદ્યામંદિરના બાળકો, પ્રજાપતિ બ્રહ્માકુમારી, શ્રીમદ્ રાજચંદ્ર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, વલસાડ જિલ્લા મહિલા પતંજલિ અને વિવિધ સંસ્થાઓ તેમજ શાળા- કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં યોગ દિનની ઉજવણીમાં સહભાગી બન્યા હતાં.

ચીખલી તાલુકામાં યોજાયેલ ચૂંટણીમાં મતદારોએ જંગી મતદાન કર્યું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૨૨ : ચીખલી તાલુકામાં દસ જેટલી ગ્રામ પંચાયતોની સરપંચની તેમજ કેટલાક ગામના વોર્ડ સભ્યોની ચૂંટણીમાં મતદારોએ ભર વરસાદમાં પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું.

જો કે આજરોજ ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં સોલધરા વોર્ડ નંબર ચારમાં ૭૫.૬૬ ટકા, આમધરા વોર્ડ નંબર ૩ માં ૮૪.૭૮ ટકા, ઘેંકટી સરપંચ માટે ૭૮.૩૨ ટકા, ઢોલુંમ્બર સરપંચ ૭૫.૫૩ નોગામા સરપંચ ૫૮.૪૩, સાદકપોર સરપંચ ૭૧.૬૨, કણભઈ ૮૩.૫૦,

સત્તાડીયા ૮૮.૩૨, શિયાદા ૬૪.૪૮, તલાવચોરા ફક્ત વોર્ડ સાંજે પં૦૦ વાગ્યા સુધીમાં માટે ૮૨.૪૦, બારોલીયા મંદિર ફળીયા ૭૭.૪૭, આંબાપાડા ૮૮.૭૭, રૂમલા ૮૧.૪૭ ટકા કરવામાં આવશે.

જાહેર સૂચના

અમો V 2 REALTY ખાતે આયોજિત SIGNATURE A & B પિક્ચર પ્રોજેક્ટ કે જેનો રેરા રજીસ્ટ્રેશન નંબર PR/GJ/VALSAD/PARDI/Others/MAA00239/250917 /તા. ૨૫/૦૮/૨૦૧૭થી ધરાવીએ છીએ આર્થિક / આયોજનમાં ફેરફાર / માર્કેટની પરિસ્થિતિ (વિગેરે) કારણસર પ્રોજેક્ટ માં આગળ વધવા માંગતા નથી અને તેથી ગુજરાત ખાતે રજીસ્ટર કરવામાં આવેલ અંમારો પ્રોજેક્ટ SIGNATURE A & B માં બ્લોક B નો રેરામાં ડી - રજીસ્ટર કરવા માંગીયે છીએ. સમગ્ર પ્રોજેક્ટ ડી - રજીસ્ટ્રેશન અન્યથે કોઈના હક્કને અસર પહોંચતી હોય કે બોર્ડિંગ કરાવેલ હોય તો તેઓને આ જાહીર નોટિસથી રજુવાત કરવા આ સાથે આમંત્રિત કરવામાં આવે છે. આધાર સહીત રજૂઆતની વિગતો nirav@v2life.in, inforera@gujarat.gov.in ના ઈમેઈલ આઈ.ડી.પાર નોટિસ પ્રસિધ્ધ થયેલ તારીખથી દિન-૧૫ માં કરવાની રહેશે.ન્યારબાદ આવેલ વાંધો ધ્યાને લેવામાં આવશે નહિ.

SIGNATURE A & B
V 2 REALTY
SURVEY NO-372 AT-CHALA
TA.VAPI.DIST.VALSAD

નિલકમલ લિમિટેડ
CIN: L25209DN1985PLC000162

રજી. ઓફિસ સર્વે નં. ૩૫૪/૨ અને ૩૫૪/૩, રાખોલી પુલ પાસે, સિલવાસા-ખાનવેલ રોડ, વાસોના ગામ, સિલવાસા-ઉદરેર ૩૦ (કાદરા અને નગર હલેલીનો કેન્ડાસાલિત પ્રદેશ)
ટેલિ.નં.: ૦૨૬૦-૨૬૯૮૮૧૨, ફેક્સ: ૦૨૬૦-૨૬૯૮૮૨૩
વેબસાઈટ: www.nilkamal.com, ઈમેલ: Investor@nilkamal.com

ઉત્તમી વાર્ષિક સાધારણ સભા (એજએમ) વિડીયો કોન્ફરન્સિંગ (વીસી-“ફક્”) / અન્ય ઓડિયોવિઝ્યુઅલ સાધનો (ઓવમ-“ઇફર”) દ્વારા યોજવા અંગેની જાણકારી

વાર્ષિક સાધારણ સભા(એન્યુઅલ જનરલ મીટિંગ)- શેરધારકો નોંધી લે કે કંપની પાસે, ૨૦૧૩ અને એની હેઠળ નિર્ધારિત નિયમોની લાગુ પડતી જોગવાઈઓ અને ૫ સિલ્વોટરીટીઝ એન્ડ એક્સન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (કેબી)(લિસ્ટિંગ ઓથોરિટીઝ એન્ડ રિસ્કોઝર જરૂરિયાતો) નિયમો, ૨૦૧૫ને કોર્પોરેટ અફેર્સ મેન્યુઅલ (એમસીએ) દ્વારા ઈસ્યુ કરાયેલ સામાન્ય પ રિપન નં. ૧/૪૨૦૨૦ તા. ૦૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિપત્ર નં. ૧/૭/૨૦૨૦ તા. ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ને અનુસાર પરીપત્ર નં. ૨/૦/૨૦૨૦ તા.૦૮મી મે, ૨૦૨૦, પરિપત્ર નં. ૦૨/૨૦૨૧, તા. ૧૩મી જાન્યુઆરી, ૨૦૨૧ અને પરિપત્ર નં. ૧/૦/૨૦૨૨ તા. ૨૮મી ડિસેમ્બર, ૨૦૨૨, પરિપત્ર નં. ૦૮/૨૦૨૩ તા. ૨૫મી સપ્ટેમ્બર, ૨૦૨૩, પરિપત્ર નં. ૦૮/૨૦૨૪ તા. ૧૯મી સપ્ટેમ્બર, ૨૦૨૪, વીસી દ્વારા એજએમ યોજવા માટે એક્સન્જ બોર્ડ અને કેબી દ્વારા ઈસ્યુ કરાયેલ સરકારી પરિપત્ર નં. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2023/167 તા.૦૭મી ઓક્ટોબર, ૨૦૨૩, SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2024/133 તા.૦૩મી એપ્રિલ, ૨૦૨૪ને એમસીએ અને કેબીના આ અંગેના અન્ય લાગુ પડતા સરકારી સંકલિતના પાલન સાથે એજએમની નોટિસમાં જણાવેલ વ્યવસાયના વ્યવહારો અંગે કંપનીની ૩૯મી વાર્ષિક સાધારણ સભા(એજએમ) વીસીઓવમ દ્વારા સુધાર, જુલાઈ ૧૯, ૨૦૨૫ના રોજ સવારે ૧૧.૦૦ (આ.સ.સ.) વાગે યોજવામાં આવશે.

ઉપરના સર્ક્યુલરો અનુસાર, જેમના ઈમેઈલ એડ્રેસીસ કંપની રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્સી ડિપોઝિટરી ભાગીદાર(સી) (ડીપી) પાસે નોંધાયેલા છે તે તમામ શેરધારકોને કંપની એજએમની નોટિસ અને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫નો સંકલિત વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઈટ www.nilkamal.com પર, કંપનીના રજિસ્ટ્રાર ડીપોઝિટરી શેર જમ્પ લિસ્ટે છે તે સ્ટોક એક્સ્ચેન્જ સીએસઈ લિમિટેડની વેબસાઈટ www.bseindia.com, નેશનલ સ્ટોક એક્સન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડની વેબસાઈટ www.nseindia.com અને નેશનલ સિલ્વોટરીટી ડિપોઝિટરી લિમિટેડ(એનએસડીએલ)ની વેબસાઈટ www.evoting.nsdl.com પર પણ ઉપલબ્ધ કરાશે.

મતદાનની માહિતી: કંપની સરકારી મીડિયમમાં મુકાનાર તમામ દરારો પર સભ્યો તેમના મત ઈલેક્ટ્રોનિકલી આપી શકે તે માટે રિમોટ ઈન્-વોટિંગની સુવિધા આપતા પુખ્તી અનુબંધ છે. ઈન્-વોટિંગની સુવિધા એજએમ ખાતે પણ મળી રહેશે અને વીસીઓવમ મારફતે એજએમમાં જોડાનારા સભ્યો, જેઓએ તેમનો મત રિમોટ ઈન્-વોટિંગથી ન આપ્યો હોય તેઓ એજએમ વખતે મત આપી શકશે. કંપનીએ રિમોટ ઈન્-વોટિંગ/એજએમ વખતે ઈન્-વોટિંગની સગવડ માટે એનએસડીએલની સેવાઓ લીધી છે. રિમોટ ઈન્-વોટિંગનો ચાલો મંચગવાર, ૧૫મી જુલાઈ, ૨૦૨૫(આ.સ.સ. સવારે ૦૮.૦૦ વાગે)ના રોજ શરૂ થશે અને સુધાર, ૧૭મી જુલાઈ, ૨૦૨૫ (આ.સ.સ. સાંજે ૦૫.૦૦ વાગે) બંધ થશે. આ સમય દરમિયાન કટ-ઓફ તારીખ શુક્રવાર, ૧૧મી જુલાઈ, ૨૦૨૫ના રોજ ફ્રિડેઝ અથવા ઈમિડિયાટિયુઅલ્ય અરૂપમાં કંપનીના શેર ધરાવતા શેરધારકો ઈલેક્ટ્રોનિકલી તેમનો મત આપી શકશે. તે પછી એનએસડીએલ દ્વારા રિમોટ ઈન્-વોટિંગ મોડ્યુલ બંધ કરી દેવાશે. સભ્યોના મતાધિકારો કટ-ઓફ તારીખ શુક્રવાર, ૧૧મી જુલાઈ, ૨૦૨૫ના રોજ કંપનીની વેબસાઈટ ઈલેક્ટ્રોનિક વોટિંગ વીડિયો રેકર્ડિંગ મોડ્યુલ બંધ કરી દેવાશે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ શ્રી બાલકર ઉપાધ્યાય (એડીઓએસ ૮૬૬૩, સીપી ૮૬૨૫) એ. એન. એલ. બાટિયા એન્ડ એસોસિએટ્સના ભાગીદાર, જણીતા કંપની સેક્રેટરીની જુદા અને પારકસી પદતિએ મતદાન પ્રક્રિયાના સંચાલન માટે સુટિનાર્દાર તરીકે નિમણૂક કરી છે. કોઈ પણ વ્યક્તિ નોટિસ મોકલાયા પછી કંપનીના શેર મેળવે છે અને કંપનીના સભ્ય બને છે અને કટ-ઓફ તારીખ શેર ધારક છે તેઓ evoting@nsdl.co.in ને વિનંતી મોકલીને લોગ ઈન આઈડી અને પાસવર્ડ મેળવી શકે છે. તેમ છતાં, જે તેમની એનએસડીએલ ખાતે અગાઉ રિમોટ ઈન્-વોટિંગ માટે નોંધણી થયેલ હોય તો તેઓ મત આપવા માટે તેમના તે ફુલર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી શકે છે. વીસીઓવમ દ્વારા એજએમમાં જોડાવા માટે અને રિમોટ ઈન્-વોટિંગ/એજએમ વખતે ઈન્-વોટિંગ દ્વારા મત આપવા માટેની સૂચનાઓ એજએમની નોટિસમાં આપવામાં આવેલ છે. સભ્યોને વિનંતી કે તેઓ તે કાયદુપૂર્વક વાંચી જાં. જે સભ્યોને એજએમ અગાઉ કે તે દરમિયાન ઈન્-વોટિંગની સુવિધા અને/અથવા વીસીઓવમ સુવિધા અંગે કોઈ મંદ જાહેરની હોય, તો તેઓ evoting@nsdl.co.in ને વિનંતી મોકલી શકે છે અથવા ટોલ ફ્રી નંબર ૦૨૨-૪૮૮૯૦૦૦૦નો ઉપયોગ કરી શકે છે.

ઈન્ટરનેટ કોન્ટેન્ટની ચુકવણી: શેરધારકો ધ્યાનમાં લે કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેમની જુલવાર, ૧૪મી મે, ૨૦૨૫ના રોજ જોગવાઈ મીડિયમમાં ૩૧મી માર્ચ, ૨૦૨૫ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે રૂ. ૧૦/-ની કેસેલેર્યુ ધરાવતા કુલ્લી પેઈડ અપ દરેક ઈક્વિટી શેર ઈન્ટરનેટ ડિવિડન્ડ રૂ. ૨૦/- (અંકે રૂપિયા વીસ પૂરા)(ઈન્ટરનેટ ડિવિડન્ડ) કંપનીની આવનાર એજએમમાં શેરધારકોની મંજૂરીને આધીન મંજૂર કરેલ છે અને ભલામણ કરેલ છે. જે શેરધારકો મંજૂરી આપે, તો શુક્રવાર, ૧૧મી જુલાઈ, ૨૦૨૫ પહેલે જે શેરધારકોના નામ સભ્યોના રજિસ્ટર અથવા લાભાર્થી માલિકના રજિસ્ટરમાં હશે, તેમને ઈન્ટરનેટ ડિવિડન્ડ શુક્રવાર, ૨૫મી જુલાઈ, ૨૦૨૫ના રોજ કે તે પછી ચુકવવામાં આવશે. વધુમાં, વાર્ષિક સાધારણ સભા(એજએમ) ડિવિડન્ડના વેતુથી કંપનીના સભ્યોનું રજિસ્ટર અને શેર ટ્રાન્સફર બુક્સ શનિવાર, ૧૨મી જુલાઈ ૨૦૨૫થી શુક્રવાર ૧૮મી જુલાઈ, ૨૦૨૫ (બંને દિવસોસહિત) બંધ રહેશે. વધુમાં, જેમના બેંક ખાતાની વિગતો અપેટેડ નહીં કરાવી હોય, તેમને ડિવિડન્ડ ચોન્ટ્રોલ/ડિમાન્ડ ડ્રાફ્ટસ તેમના નોંધાયેલ સરનામે જે તે સમયે મોકલી આપવામાં આવશે. શેરધારકોને જાણ હશે, કે આવકવેરા પાડા, ૧૯૬૧(આઈટી એક્ટ) મુજબ, નાણાકીય પાડા, ૨૦૨૦ દ્વારા સુધાર્યા મુજબ ૧લી એપ્રિલ ૨૦૨૦ પછી કંપની દ્વારા ચુકવાયેલ કે વર્ધાયેલ ડિવિડન્ડ, શેરધારકોના ખાતે કરવાય બને છે અને કંપનીએ આવનાર એજએમમાં શેરધારકોની મંજૂરીને આધીન ડિવિડન્ડ માટે સુધિત ફરે ટેક્સ એટ સોર્સ (ટીટીએસ) કાયદાનો હોય છે. ટીટીએસના દર શેરધારકોના રોએક્સની સ્થિતિ અને તેમણે આપેલા અને કંપનીએ સ્વીકારેલા દસ્તાવેજો પર આધારિત જુદા હોય છે. વિગતવાર ટેક્સના દરો, રાહત માટેના કોર્સ અને અન્ય દસ્તાવેજો સહિત લાગુ પડતા કરવેરાના દરો સહિત સદર માહિતી કંપનીની વેબસાઈટ https://www.nilkamal.com પર ઉપલબ્ધ છે. શેરધારકોને વિનંતી છે કે તેઓ આઈડી કાયદાની લાગુ પડતી જોગવાઈઓ અનુસાર દસ્તાવેજો જમા કરાવે. શેરધારકોને સેબીની જોગવાઈઓ અનુસાર ડિજિટલ સરૂપમાં શેર ધરાવતા તમામ શેરધારકો માટે યાન, નોમિનેશનની પસંદગી, સંપંદની વિગતો(પીન કોડ અને મોબાઈલ નંબર સાથે પોસ્ટલ એડ્રેસ), બેંક ખાતાની વિગતો અને નમુનાની સહી તેમના કોલિઓ નંબર સાથે રજૂ કરવી ફરજિયાત છે તેની નોંધ લેવા વિનંતી છે. શેરધારકો તેમની ઉપરોક્ત વિગતો સુધિત કોર્મ આઈએસઆર-૧માં અને અન્ય સંબંધિત કોર્મમાં કંપનીના રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્સી એન્યુઅલ ઈન્ટરાર્ટમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (લિક ઈન્ટરાર્ટમ)ને નોંધાવીઅપેટેડ કરાવી શકે છે. વધુમાં, શેરધારકો કંપનીની વેબસાઈટ https://www.nilkamal.com પર પણ સંબંધિત કોર્સ જોઈ શકે છે. ઉપરની વિગતો કંપનીના તમામ શેરધારકોની જાણકારી અને લાભાર્થી અને એમસીએ તથા સેબી પરીપત્ર(સી)ના પાલન અર્થે જાહેર કરેલ છે. શેરધારકો કંપનીના રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્સી એન્યુઅલ ઈન્ટરાર્ટમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, સી-૧૦૧, ૧લી માળે, ૪૪૭ પાર્ક, લાલ બહદુર શાસ્ત્રી માર્ગ, વિકોલી(પશ્ચિમ), મુંબઈ-૪૦૦૦૮૩નો સંપર્ક કરી શકે છે. ટેલિ. નં. +૯૧ ૮૧૦૮૧ ૧૬૯૭૨ ઈમેલ: mt.helpdesk@nilkamal.com, mops.mnf@nilkamal.com

સ્થળ: મુંબઈ તારીખ: ૨૩મી જૂન, ૨૦૨૫ કંપની સચિવ અને અનુપાલન અધિકારી